

DU-101

December-2013

M.Com. (Sem.-I)**406 : Accounting for Managers****Time : 3 Hours]****[Max. Marks : 70**

1. (A) યોગ્ય વિકલ્પની પસંદગી કરો : (ગમે તે સાત)

7

Select appropriate alternative. (Any seven)

(1) નાણાંકીય પત્રકોમાં સમાવેશ થાય છે.

- | | |
|----------------------|-----------------------|
| (a) નફા-નુકસાન ખાતું | (b) રોકડ પ્રવાહ પત્રક |
| (c) પાકું સરવૈયું | (d) ઉપરના બધા જ |

Financial Statements include

- | | |
|-------------------|-------------------------|
| (a) P & L Account | (b) Cash Flow Statement |
| (c) Balance Sheet | (d) All of the above |

(2) હિસાબી ધોરણો કોણ બહાર પાડે છે ?

- | | |
|----------|-----------|
| (a) ICAI | (b) ICWAI |
| (c) ICSI | (d) CLB |

Accounting Standards are issued by

- | | |
|----------|-----------|
| (a) ICAI | (b) ICWAI |
| (c) ICSI | (d) CLB |

(3) આજ સુધી કેટલા હિસાબો ધોરણો બહાર પાડવામાં આવ્યા છે ?

- | | |
|--------|--------|
| (a) 26 | (b) 32 |
| (c) 24 | (d) 20 |

How many accounting standards are issued till today ?

- | | |
|--------|--------|
| (a) 26 | (b) 32 |
| (c) 24 | (d) 20 |

(4) ભારતીય GAAP મુજબ નાણાંકીય પત્રકો કઈ કિંમતે રજૂ થાય છે

- | | |
|--------------------|-----------------------|
| (a) બજાર કિંમત | (b) વાજબી કિંમત |
| (c) ઐતિહાસિક કિંમત | (d) પુનઃસ્થાપના કિંમત |

As per Indian GAAP financial statements are presented at

- | | |
|----------------------|-----------------------|
| (a) Market Value | (b) Fair Value |
| (c) Historical Value | (d) Replacement Value |

(5) અલગ અસ્તિત્વનો ખ્યાલ નીચેના પૈકી કયા ધંધાને લાગુ પડે ?

- | | |
|-------------------|-----------------|
| (a) એકાંકી વેપારી | (b) કંપની |
| (c) પેઢી | (d) ઉપરના બધા જ |

The concept of separate entity is applicable to which of the following types of business ?

- | | |
|-------------------------|----------------------|
| (a) Sole Proprietorship | (b) Company |
| (c) Firm | (d) All of the above |

(6) IFRS કોણ બહાર પાડે છે ?

- (a) IASB (b) FASB
(c) ICAI (d) IASC

IFRS are issued by

- (a) IASB (b) FASB
(c) ICAI (d) IASC

(7) ચોખ્ખા નફાના 10% લેખે અનામત ખાતે ફરજિયાત ફેરબદલી કરવા માટે ભલામણ કરેલ ડિવિડંડ

- (a) 10% થી વધુ પરંતુ 12.5% થી વધુ નહી
(b) 20% થી વધુ
(c) 15% થી વધુ પરંતુ 20% થી વધુ નહી
(d) 12.5% થી વધુ પરંતુ 15% થી વધુ નહી

Compulsory transfer to reserve 10% of net profit, if dividend cleared is

- (a) Exceeds 10% but not exceeds 12.5%
(b) Exceeds 20%
(c) Exceeds 15% but not exceeds 20%
(d) Exceeds 12.5% but not exceeds 15%

(8) નીચેના પૈકી કઈ વિગત અનામત અને વધારાના શીર્ષક હેઠળ ન આવે ?

- (a) મૂડી પરત અનામત (b) સામાન્ય અનામત
(c) પ્રોવિડંડ ફંડ (d) સીકિંગ ફંડ

Which of the following items does not come under reserves and surplus ?

- (a) Capital redemption reserve (b) General reserve
(c) Provident fund (d) Sinking fund

(9) તારણવાળી લોન પર ચઢેલું અને દેવું થયેલું વ્યાજ નીચેના શીર્ષક હેઠળ દર્શાવાય :

- (a) ચાલુ જવાબદારી (b) અનામત અને વધારો
(c) તારણવગરની લોન (d) તારણવાળી લોન

Interest accrued and due on secured loan is shown under the head

- (a) Current liabilities (b) Reserve and Surplus
(c) Unsecured loan (d) Secured loan

(10) તારણવાળી લોન પર ચઢેલું પરંતુ દેવું નહી થયેલું વ્યાજ નીચેના શીર્ષક હેઠળ દર્શાવાય :

- (a) ચાલુ જવાબદારી (b) તારણવાળી લોન
(c) તારણવગરની લોન (d) અનામત અને વધારો

Interest accrued but not due on secured loan is shown under the head

- (a) Current liabilities (b) Secured loan
(c) Unsecured loan (d) Reserve and surplus

(B) નાણાંકીય પત્રકોના લક્ષણોની ચર્ચા કરો.

7

Characteristics of financial statements.

અથવા/OR

હિસાબી ધોરણો એટલે શું ? હિસાબી ધોરણો બહાર પાડવાની પ્રક્રિયા સમજાવો.

What is accounting standards ? Explain the procedure for issue of accounting standards.

2. વિશ્વા લિમિટેડની નીચેની માહિતી પરથી તમારે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે.

14

ભરપાઈ થયેલ શેરમૂડી	₹ 20,00,000
અનામતો સાથે શેરમૂડીનો ગુણોત્તર	1
ચોખ્ખી કાર્યશીલ મૂડી સાથે માલિકી ભંડોળનો ગુણોત્તર	0.3
વેચાણ સાથે માલિકી ભંડોળનો ગુણોત્તર	1.5
વેચાણ સાથે કાયમી મિલકતોનો ગુણોત્તર	2
વેચાણ સાથે દેવાદારનો ગુણોત્તર	6
કાચા નફાનો ગુણોત્તર	20%
સ્ટોક ચલનદર	2 મહિના
માલિકી ભંડોળ સાથે લાંબા ગાળાના દેવાંનો ગુણોત્તર	20
ચાલુ ગુણોત્તર	2.5
પ્રવાહી ગુણોત્તર	1.5
બેંક ઓવરડ્રાફ્ટ નથી એમ ધારો.	

From the following information relating to Vishwa Ltd. You are required to prepare its Balance Sheet.

Paid up share capital	₹ 20,00,000
Reserve to share capital ratio	1
Net working capital to proprietors fund ratio	0.3
Sales to proprietors fund ratio	1.5
Sales to fixed assets ratio	2
Sales to debtors ratio	6
Gross profit ratio	20%
Stock turnover ratio	2 months
Proprietors fund to long term debt ratio	20
Current ratio	2.5
Liquid ratio	1.5

Assume there is no bank overdraft.

અથવા/OR

PDPMCC લિમિટેડના તા. 31-03-2012 અને તા. 31-03-2013 ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે :

જવાબદારીઓ	31/3/12 (₹)	31/3/13 (₹)	મિલકતો	31/3/12 (₹)	31/3/13 (₹)
ઈક્વિટી શેરમૂડી	6,00,000	12,00,000	પાઘડી	1,50,000	1,20,000
દરેક ₹ 10 નો તેવા			જમીન અને મકાન	4,80,000	7,20,000
10% ના રિડી. પ્રેફ. શેર			સાંચા અને યંત્રો	5,70,000	9,00,000
શેરદીઠ ₹ 7 ભરપાઈ	2,10,000	–	10% ના રોકાણો	1,80,000	–
સામાન્ય અનામત	2,25,000	1,50,000	સ્ટોક	75,000	96,000
નફા-નુકસાન ખાતું	1,80,000	2,40,000	દેવાદારો	1,35,000	93,000
જામીનગારી પ્રીમિયમ	75,000	60,000	લેણી હુંડી	75,000	42,000
15% ના ડિબેંચર	3,00,000	–	બેંક સિલક	2,70,000	1,20,000
લેણદારો	1,20,000	1,50,000	પ્રાથમિક ખર્ચા	45,000	15,000
દેવી હુંડી	90,000	45,000			
કરવેરાની જોગવાઈ	1,05,000	1,35,000			
સૂચિત ડિવિડન્ડ	75,000	1,26,000			
	19,80,000	21,06,000		19,80,000	21,06,000

વધારાની માહિતી :

- (1) રોકાણો તા. 31-03-2013, ના રોજ તેની વેચાણ કિંમત 20% નફો મળે તે રીતે વેચેલા હતા.
- (2) વર્ષ દરમિયાન રોકાણો પર ₹ 18,000 વ્યાજ મળેલ છે.
- (3) તા. 31-03-2013 ના રોજ ડિબેંચર 3% ના પ્રીમિયમથી પરત કરેલ છે અને ડિબેંચર પર ₹ 45,000 વ્યાજ ચૂકવેલું હતું.
- (4) કંપનીએ જરૂરી કાયદાની જોગવાઈઓનું પાલન કરી રિડીમેબલ પ્રેફરન્સ શેરો 5% ના પ્રીમિયમે પરત કરેલ છે. પ્રેફરન્સ શેર પરત કરવા માટે સામાન્ય અનામતમાંથી ₹ 3,00,000 મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવેલ છે.
- (5) વર્ષ દરમિયાન જમીન મકાન પર ₹ 90,000 અને સાંચા-યંત્રો પર ₹ 1,35,000 ઘસારો માંડી વાળેલ હતો.
- (6) વર્ષ દરમિયાન ₹ 3,00,000 પડતર કિંમતનું યંત્ર કે જેનો એકત્રિત ઘસારો ₹ 1,80,000 હતો તે યંત્ર ₹ 1,35,000 માં વેચ્યું હતું.
- (7) કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2 : 1 ના પ્રમાણમાં બોનસ શેર આપેલ છે.
- (8) ગયા વર્ષના કરવેરાની રકમ ₹ 90,000 ચૂકવેલ છે અને ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ પણ ચૂકવેલ છે.

ઉપરની માહિતી પરથી હિસાબી ધોરણ – 3 મુજબનું રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. જરૂરી તમામ ગણતરી દાખલાના જવાબના ભાગરૂપે દર્શાવવાની રહેશે.

The balance sheets of PDPMCC Ltd. as on 31-03-2012 and 31-03-2013 are given below :

Liabilities	31/3/12	31/3/13	Assets	31/3/12	31/3/13
	₹	₹		₹	₹
Equity Share capital	6,00,000	12,00,000	Goodwill	1,50,000	1,20,000
10% Red. Pref. Shares of ₹ 10 each, ₹ 7 paid up	2,10,000	–	Land & Building	4,80,000	7,20,000
General reserve	2,25,000	1,50,000	Plant & Machinery	5,70,000	9,00,000
P & L Account	1,80,000	2,40,000	10% Investment	1,80,000	–
Securities Prem.	75,000	60,000	Stock	75,000	96,000
15% debentures	3,00,000	–	Debtors	1,35,000	93,000
Creditors	1,20,000	1,50,000	Bills Receivable	75,000	42,000
Bills payable	90,000	45,000	Bank balance	2,70,000	1,20,000
Prov. for taxation	1,05,000	1,35,000	Preliminary Exp.	45,000	15,000
Proposed dividend	75,000	1,26,000			
	19,80,000	21,06,000		19,80,000	21,06,000

Additional information :

- (1) On 31-03-2013, investments were sold at a profit of 20% on its sales proceeds.
- (2) During the year interest received on investment amounted to ₹ 18,000.
- (3) On 31-03-2013 debentures were redeemed at 3% premium and interest on debenture was paid ₹ 45,000.
- (4) The company has redeemed redeemable pref. shares at 5% premium after observing necessary requirements of Act. For the purpose of redemption of pref. shares, the amount of ₹ 3,00,000 has been transferred from General Reserve to Capital Redemption Reserve.
- (5) During the year depreciation written off :
On Land and Building ₹ 90,000
On Plant and Machinery ₹ 1,35,000
- (6) During the year a machine costing ₹ 3,00,000 on which accumulated depreciation was ₹ 1,80,000 was sold at ₹ 1,35,000.
- (7) The company has issued bonus shares to the existing equity share holders from capital redemption reserve in the proportion of 2 : 1
- (8) ₹ 90,000 have been paid as tax for the last year and the amount of proposed dividend of the last year has also been paid.

From the above mentioned information, prepare cash flow statement as per accounting standard – 3. All calculations are to be considered as part of the answer.

3. તા. 01-04-2012 ના રોજનું જાનકી લિ.નું પાકું સરવૈયું અને તા. 31-03-2013 ના રોજ પુરા થતાં વર્ષનું આવકનું પત્રક નીચે મુજબ છે :

14

તા. 01-04-2012 ના રોજનું પાકું સરવૈયું

જવાબદારીઓ	₹	મિલકતો	₹
શેર મૂડી	1,00,000	યંત્રો	88,000
12% ના ડિબેન્ચર	20,000	સ્ટોક	12,000
લેણદારો	20,000	દેવાદારો	20,000
		રોકડ	20,000
	1,40,000		1,40,000

તા. 31-03-2013 ના રોજ પુરા થતાં વર્ષનું આવકનું પત્રક

વિગત	₹	₹
વેચાણ		1,60,000
બાદ : વેચેલ માલની પડતર (FIFO)		
શરૂનો સ્ટોક	12,000	
+ ખરીદી	48,000	
	60,000	
બાદ : આખરનો સ્ટોક	10,000	50,000
		1,10,000
બાદ : ખર્ચા		
સંચાલન ખર્ચા	24,000	
ઘસારો	8,800	
ડિબેન્ચર વ્યાજ (તા. 31-03-2013 ના રોજ ચૂકવેલ)	2,400	35,200
		74,800

વર્ષ દરમ્યાન દેવાદારો અને લેણદારોની બાકીઓ એકસરખી રહી છે.

સામાન્ય ભાવ સૂચકાંક નીચે મુજબ હતાં :

01-04-2012	280
31-03-2013	420
સરેરાશ સૂચકાંક	350

વર્તમાન ખરીદ શક્તિની પદ્ધતિ અનુસાર ભાવ સપાટીમાં ફેરફારની અસર આપ્યા બાદ તમે 2012-13 ના વાર્ષિક હિસાબો તૈયાર કરો.

The balance sheet of Janki Ltd. as on 01-04-2012 and the income statement for the year ending on 31-03-2013 are given below :

Balance Sheet as on 01-04-2012

Liabilities	₹	Assets	₹
Share Capital	1,00,000	Machinery	88,000
12% Debentures	20,000	Stock	12,000
Creditors	20,000	Debtors	20,000
		Cash	20,000
	1,40,000		1,40,000

Income statement for the year ending on 31-03-2013

Particulars	₹	₹
Sales		1,60,000
Less : Cost of goods sold (FIFO)		
Opening stock	12,000	
+ Purchase	<u>48,000</u>	
	60,000	
– Closing stock	<u>10,000</u>	50,000
Gross Profit		1,10,000
Less : Expenses		
Operating Exp.	24,000	
Depreciation	8,800	
Interest on debentures (paid on 31-03-2013)	<u>2,400</u>	35,200
Net Profit		74,800

Debtors and Creditors balance remained constant throughout the year.

General Price index was as given below.

01-04-2012	280
31-03-2013	420
Average Index No.	350

You are required to prepare the final accounts for the year 2012-13 after adjusting for price level changes under current purchasing power (CPP) method.

અથવા/OR

3. (A) કુગાવાની વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ સમજાવો. આ સંદર્ભમાં ધારક નફાનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. 7

Explain current cost accounting method of inflation accounting. Explain in this connection the concept of holding gains with illustrations.

(B) નીચેનાના જવાબ આપો : (ગમે તે બે)

7

Answer the following : (Any two)

- (1) મૂલ્ય વૃદ્ધિનો ખ્યાલ સમજાવો.
Explain value added concept.
- (2) માનવ સંપત્તિ હિસાબોના મૂળભૂત અનુમાનો
Basic assumptions of human resources accounting
- (3) સામાજિક જવાબદારીનું કાર્યક્ષેત્ર
Scope of Social Responsibility
- (4) પર્યાવરણલક્ષી હિસાબી પદ્ધતિનો અર્થ
Meaning of Environmental Accounting

4. (A) મયુરી લિમિટેડની નીચેની માહિતી પરથી શોધો :

7

- (1) નફા જથ્થાનો ગુણોત્તર
- (2) સ્થિર ખર્ચા
- (3) સમતુલ બિંદુ
- (4) 2012 ના વર્ષ માટે સલામતીનો ગાળો
- (5) ₹ 60,000 નફો મેળવવા માટે જરૂરી વેચાણ
- (6) વેચાણ ₹ 5,00,000 હોય ત્યારે નફો
- (7) નફો ₹ 30,000 હોય ત્યારે સલામતીનો ગાળો

વર્ષ	વેચાણ (₹)	નફો (₹)
2011	2,00,000	20,000
2012	3,00,000	40,000

From the following information of Mayuri Ltd., calculate the following :

- (1) Profit Volume Ratio
- (2) Fixed Expenses
- (3) Break Even Point
- (4) Margin of safety for the year 2012
- (5) Sales to earn a profit of ₹ 60,000
- (6) Profit when sales is ₹ 5,00,000
- (7) Margin of safety when profit is ₹ 30,000

<u>Year</u>	<u>Sales (₹)</u>	<u>Profit (₹)</u>
2011	2,00,000	20,000
2012	3,00,000	40,000

અથવા/OR

(A) પડતરના વિવિધ ખ્યાલો સમજાવો.

Explain various concepts of cost.

- (B) રાજેન્દ્ર લિ.ની નીચે આપેલી વિગતો પરથી 30મી જૂન 2013 ના રોજ પુરા થતાં 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો.

7

તા. 01-04-2013 ના રોજ રોકડ અને બેંક સિલક ₹ 1,20,000

માસ	કુલ વેચાણ (₹)	વેચાણ પરત (₹)	કુલ ખરીદી (₹)	મજૂરી (₹)	પરોક્ષ ખર્ચ (₹)
ફેબ્રુઆરી	5,60,000	8,000	5,30,000	52,000	92,000
માર્ચ	6,40,000	12,000	4,80,000	56,000	60,000
એપ્રિલ	8,00,000	20,000	5,60,000	48,000	88,000
મે	7,20,000	16,000	6,00,000	64,000	1,00,000
જૂન	6,80,000	24,000	6,40,000	72,000	1,20,000

- (1) રોકડ વેચાણ અને ઉધાર વેચાણનું પ્રમાણ 1 : 4 ધારો.
- (2) કુલ ખરીદીના 20% રોકડ ખરીદી ધારો.
- (3) ચોખ્ખા ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિનામાં મળે છે.
- (4) ₹ 2,00,000 ના ચંત્રોની ડિલિવરી મે-2013 માં મળશે. જેનાં 10% નાણાં તરત જ ચૂકવવા પડશે અને બાકીની રકમ 3 માસ પછી ચૂકવવાની છે.
- (5) વેપારીઓએ આપેલો શાખનો સમયગાળો 1 મહિનો છે.
- (6) મજૂરી ચૂકવણીનો સમયગાળો ¼ માસ છે.
- (7) પરોક્ષ ખર્ચ ચૂકવવાનો સમયગાળો ½ માસ છે.

From the following information of Rajendra Ltd., prepare a Cash Budget for the 3 months ending on 30-06-2013.

Cash and Bank Balance as on 01-04-2013 is ₹ 1,20,000

Month	Total Sales (₹)	Sales Return (₹)	Total Purchase (₹)	Wages (₹)	Overheads (₹)
February	5,60,000	8,000	5,30,000	52,000	92,000
March	6,40,000	12,000	4,80,000	56,000	60,000
April	8,00,000	20,000	5,60,000	48,000	88,000
May	7,20,000	16,000	6,00,000	64,000	1,00,000
June	6,80,000	24,000	6,40,000	72,000	1,20,000

- (1) Assume the proportion of cash sales and credit sales as 1 : 4
- (2) Assume 20% of total purchase to be cash purchase.
- (3) 50% of credit sales are collected in the month following the sales and remaining 50% in the second month following the sales.
- (4) Plants costing ₹ 2,00,000 is due for delivery in May-2013 payable 10% on delivery and the balance after 3 months.
- (5) The period of credit allowed by suppliers in one month.
- (6) Time lag in payment of wages is ¼ month.
- (7) Time lag in payment of overheads is ½ month.

અથવા/OR

- (B) શૂન્ય આધારીત અંદાજપત્ર એટલે શું ? તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો.
What is zero based budgeting ? Explain its advantages and limitations.

5. યોગ્ય વિકલ્પની પસંદગી કરો :

14

Select appropriate alternative :

(1) IFRS મુજબ નાણાંકીય પત્રકો કઈ કિંમતે રજૂ થાય છે ?

- (a) બજાર કિંમત (b) વાજબી કિંમત
(c) ઐતિહાસિક કિંમત (d) પુનઃસ્થાપના કિંમત

As per IFRS financial statements are presented at

- (a) Market Value (b) Fair Value
(c) Historical Value (d) Replacement value

(2) ઢોર-ઢાંખર નીચેના પૈકી કયા શિર્ષક હેઠળ દર્શાવાય ?

- (a) ચાલુ મિલકતો (b) રોકાણો
(c) કાયમી મિલકતો (d) અદૃશ્ય મિલકતો

Live stock shown under the head

- (a) Current assets (b) Investments
(c) Fixed assets (d) Intangible assets

(3) શેરમાં રોકાણ પૈકી નહી મંગાવેલ હપ્તાની રકમ નીચેના પૈકી કયા શિર્ષક હેઠળ દર્શાવાય ?

- (a) રોકાણો (b) ચાલુ મિલકતો
(c) ચાલુ ઢેવાં (d) સંશયિત ઢેવું

The uncalled amount in investment in shares are shown under the head

- (a) Investments (b) Current assets
(c) Current Liability (d) Contingent Liabilities

(4) ઉઢીના નાણાંની પડતર અંગેનું હિસાબી ઢોરણ

- (a) AS – 16 (b) AS – 15
(c) AS – 17 (d) AS – 18

Borrowing cost is dealt with by

- (a) AS – 16 (b) AS – 15
(c) AS – 17 (d) AS – 18

(5) ખૂબ ઉંચો ચાલુ ગુણોત્તર

- (a) નફાકારકતા વધારશે (b) નફાકારકતા ઘટાડશે
(c) નફાકારકતા પર અસર થશે નહીં (d) ઉપરના પૈકી એકપણ નહીં

A very high current ratio will

- (a) Increase Profitability (b) Decrease Profitability
(c) Not affect on Profitability (d) None of the above

(6) ગૌણ કંપનીની ખરીદી એ

- (a) કામગીરી પ્રવૃત્તિ ગણાય (b) નાણાંકીય પ્રવૃત્તિ ગણાય
(c) રોકાણ પ્રવૃત્તિ ગણાય (d) ઉપરના પૈકી એકપણ નહીં

Acquisition of a subsidiary company is a

- (a) Operating Activity (b) Financing Activity
(c) Investing activity (d) None of the above

(7) સીમાંત પડતર પદ્ધતિ મુજબ કુલ ફાળો

- (a) કુલ સ્થિર ખર્ચ + કુલ નફો
- (b) કુલ સ્થિર ખર્ચ – કુલ ખોટ
- (c) કુલ વેચાણ – કુલ ચલિત ખર્ચ
- (d) ઉપરના બધા જ

Under marginal costing which of the following is total contributions

- (a) Total Fixed Cost + Total Profit
- (b) Total Fixed Cost – Total Loss
- (c) Total Sales – Total Variable cost
- (d) All of the above

(8) નીચેના પૈકી કઈ વિગત કુલ સ્થિર ખર્ચ ગણાય ?

- (a) કુલ ફાળો – કુલ નફો
- (b) કુલ ફાળો – કુલ ખોટ
- (c) સમતુટ બિંદુ (₹) × નફા જથ્થાનો ગુણોત્તર
- (d) ઉપરના બધા જ

Which of the following is total fixed cost ?

- (a) Total Contribution – Total Profit
- (b) Total Contribution – Total Loss
- (c) BEP (₹) × Profit Volume Ratio
- (d) All of the above

(9) જો શરૂનો સ્ટોક ₹ 29,000, આખરનો સ્ટોક ₹ 31,000, વેચાણ ₹ 3,00,000 અને કાચા નફાનો દર પડતર પર 25% હોય તો સ્ટોક ચલન દર

- (a) 8 વખત
- (b) 7 વખત
- (c) 7.5 વખત
- (d) 9 વખત

If opening stock ₹ 29,000, closing stock ₹ 31,000, sales ₹ 3,00,000 and G. P. Ratio 25% on cost, then Stock turnover ratio will be

- (a) 8 times
- (b) 7 times
- (c) 7.5 times
- (d) 9 times

(10) લાંબા ગાળાના દેવાનું ચૂકવેલ વ્યાજ

- (a) રોકાણ પ્રવૃત્તિ ગણાય
- (b) નાણાકીય પ્રવૃત્તિ ગણાય
- (c) કામગીરી પ્રવૃત્તિ ગણાય
- (d) ઉપરના પૈકી એકપણ નહીં

Interest paid on long term borrowing is a

- (a) Investing Activity
- (b) Financing Activity
- (c) Operating Activity
- (d) None of the above

(11) જો શરૂનો સ્ટોક ₹ 40,000, ખરીદી ₹ 3,20,000 અને આખરનો સ્ટોક ₹ 60,000, તથા શરૂનો સૂચકાંક 200, આખરનો સૂચકાંક 240 અને સરેરાશ સૂચકાંક 220 હોય તો વેચાણ પડતરનો હવાલો

- (a) ₹ 12,000 (b) ₹ 31,000
(c) ₹ 9,000 (d) ₹ 18,000

Which of the following is cost of sales adjustment, if opening stock ₹ 40,000, purchase ₹ 3,20,000, closing stock ₹ 60,000, opening price index 200, closing price index 240 and average price index 220 ?

- (a) ₹ 12,000 (b) ₹ 31,000
(c) ₹ 9,000 (d) ₹ 18,000

(12) જો શરૂની નાણાંકીય કાર્યશીલ મૂડી ₹ 2,40,000 અને આખરની નાણાંકીય કાર્યશીલ મૂડી ₹ 4,80,000, તથા શરૂનો સૂચકાંક 200, આખરનો સૂચકાંક 240 અને સરેરાશ સૂચકાંક 220 હોય તો નાણાંકીય કાર્યશીલ મૂડીનો હવાલો

- (a) ₹ 80,000 (b) ₹ 1,00,000
(c) ₹ 48,000 (d) ₹ 64,000

Which of the following is monetary working capital adjustment, if opening monetary working capital ₹ 2,40,000, closing monetary working capital ₹ 4,80,000, opening price index 200, closing price index 240 and average price index 220 ?

- (a) ₹ 80,000 (b) ₹ 1,00,000
(c) ₹ 48,000 (d) ₹ 64,000

(13) જો ચલિત ખર્ચ ગુણોત્તર 60% હોય તો ₹ 1,20,000 નફો હોય ત્યારે સલામતીનો ગાળો

- (a) ₹ 3,00,000 (b) ₹ 2,00,000
(c) ₹ 1,80,000 (d) ₹ 4,00,000

Which of the following is margin of safety at a profit of ₹ 1,20,000, if variable cost ratio is 60% ?

- (a) ₹ 3,00,000 (b) ₹ 2,00,000
(c) ₹ 1,80,000 (d) ₹ 4,00,000

(14) જો કુલ દેવું ₹ 90,000, રોકાયેલ મૂડી ₹ 1,20,000 અને ચાલુ દેવું ₹ 10,000 હોય તો દેવાં ઈક્વિટી ગુણોત્તર

- (a) 3 : 1 (b) 2 : 1
(c) 2.5 : 1 (d) 1 : 2

What will be the debt equity ratio, if total debt is ₹ 90,000, capital employed is ₹ 1,20,000 and current liability is ₹ 10,000 ?

- (a) 3 : 1 (b) 2 : 1
(c) 2.5 : 1 (d) 1 : 2